

પ્રકરણ - ૭

શિક્ષણ ક્ષેત્રે કાર્ય સિદ્ધિ

કચ્છ જિલ્લાના પંચાયતના કાર્યક્ષેત્રમાં આવેલ તમામ શાળાઓનું સંચાલન જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ કરે છે. શાળા ના સંચાલન માં વહીવટી તેમજ શૈક્ષણિક કામગીરી તથા શિક્ષણની ગુણવત્તા સુધારવાનાં પ્રયાસો થાય છે. પ્રાથમિક શાળાઓમાં મોનીટરીંગ, શિક્ષકોની નિમણૂક, શિક્ષણ નાં વહીવટી માળખા નું સંચાલન, નવી શાળા મંજૂરી શૈક્ષણિક સાધનો પુરા પાડવાની કામગીરી, શાળા ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી ને પ્રોત્સાહન, વિદ્યાલક્ષ્મી પરીક્ષાનું આયોજન વિગેરે કામગીરી તથા વ્યવસ્થા સંચાલન શિક્ષણ સમિતિ હસ્તક થાય છે. આ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનાં વેતન માટે ગ્રાન્ટ ફાળવણી, પરચુરણ કન્ટીજન્સી, શાળા પ્રવેશોત્સવ, નિરોગી બાળવર્ષ, ભૌતિક સુવિધા માટેની તાલુકા પંચાયતોને શાળાકીય ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓ નું નામાંકન

શૈક્ષણિક દૃષ્ટિએ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા ગામની વસતિના ધોરણે સાર્વત્રિક મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું નીતિના ધોરણોનું પાલન થાય છે. પ્રાથમિક કક્ષાએ પછાત વિસ્તારના અને નબળા વિસ્તારના વર્ગના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે અંગે પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ અંગે દર વર્ષે ઉનાળુ વેકેશન બાદ નવા સત્રની શરૂઆતમાં શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે અને ૧૦૦ ટકા નામાંકનનાં ધ્યેય હાંસલ કરવાનાં પ્રયત્નો કરવામાં આવે છે.

ક્રમ	વિગત	સંખ્યા (વર્ષ : ૨૦૧૭-૧૮)
૧	પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા	૨૪૬૩૬
૨	પુન: પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા	૦૦
૩	કુલ પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા	૨૪૬૩૬
૪	પ્રવેશ મેળવેલ બાળકોની સંખ્યા	૨૪૬૫૮
૫	પુન: પ્રવેશ મેળવેલ બાળકોની સંખ્યા	૧૧૩
૬	કુલ પ્રવેશ મેળવેલ બાળકોની સંખ્યા	૨૪૭૫૨
૭	નામાંકન ટકાવારી	૧૦૦.૫૫ %

નવી શાળાઓ

પ્રાથમિક શિક્ષણનાં સાર્વત્રિકરણનો હેતુ તેમજ નાના બાળકોને ઓછા અંતરે પ્રાથમિક શિક્ષણ ની સુવિધા પ્રાપ્ત થાય તે માટે નવી વસાહત તથા વાડી વિસ્તારના નાગરિકોની નવી શાળા શરૂ કરવા અંગે આવેલ માંગણી અન્વયે શિક્ષણ સમિતિની મંજૂરી લઈ વાડી વિસ્તાર/નવા વસવાટના વિસ્તારમાં શાળા શરૂ કરવામાં આવે છે.

શાળાઓ	વર્ષ : ૨૦૧૭-૧૮
નવી પંચાયતી પ્રાથમિક શાળાની મંજૂરી	૯
નવી ખાનગી પ્રાથમિક શાળાની	૩૯

શાળાઓમાં વિવિધ ભૌતિક સાધનો પુરા પાડવા

જિલ્લાની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા તેમજ સુવિધા ઊંભી કરવાના હેતુથી શાળાઓમાં વિવિધ ભૌતિક સાધનો જેવા કે ફ્લેટ એઈડ બોક્ષ, સાયન્સ કીટ, બેન્ચ વગેરે પુરા પાડવામાં આવે છે.

ભૌતિક સુવિધા વાડી શાળાઓ

શાળાઓમાં ઓરડા, વીજળીકરણ, સેનીટેશન, કમ્પાઉન્ડ વોલ, પીવાના પાણીની વ્યવસ્થાની જરૂરીયાત રહે છે. એસ.એસ.એ.એમ. નાં સહયોગથી ઉપરોક્ત જરૂરિયાતો પુરી પાડવામાં આવે છે.

વિગત	સંખ્યા વર્ષ : ૨૦૧૭-૧૮
શાળાઓમાં ઓરડા	૧૨૩૦૨
વીજળીકરણ	૧૭૪૩
સેનીટેશન	૫૬૩૭
પીવાનું પાણી	૧૬૬૯
કમ્પાઉન્ડ વોલ	૧૫૮૩
રમત મેદાન	૧૪૮૧
ટી.વી. સેટ	-

વિદ્યાર્થીઓ ની માહિતી

વિદ્યાર્થીઓ	ધોરણ : ૧ થી ૮
કુમાર	૧૨૩૩૭૮
કન્યા	૧૨૦૨૯૩
કુલ	૨૪૩૬૭૧

શિક્ષકો ની માહિતી

શિક્ષક	ધોરણ : ૧ થી ૫	ધોરણ : ૬ થી ૮
	વર્ષ : ૨૦૧૭-૧૮	વર્ષ : ૨૦૧૭-૧૮
મંજુર મહેકમ	૫૭૪૪	૪૭૩૫
કામકરતા શિક્ષકો	૪૭૩૪	૩૫૩૬
ખાલી જગ્યા	૧૦૧૦	૧૧૯૯

સર્વશિક્ષા અભિયાન મિશન અંતર્ગત ભૌતિક સુવિધા

ક્રમ	ભૌતિક સુવિધા	ફાળવેલ યુનિટ	પૂર્ણ થયેલ યુનિટ	લક્ષ્યાંક
૧	વર્ગ ખંડ	૨૦૪	૨૫	૧૨.૨૫%
૨	વર્ગ ખંડ (ધો. ૮)	૦	૦	૦
૩	ટોયલેટ બ્લોક	૧૨૯	૧૨૯	૧૦૦%

વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના

જિલ્લા શિક્ષણ સમિતિ, કચ્છ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં જે ગામડાઓમાં સ્ત્રી સાક્ષરતા દર ૩૫ % કરતા ઓછું છે તેવા ગામોની કન્યાઓ કે જે ધોરણ -૧ માં દાખલ થાય તેમને સરકાર દ્વારા રૂ. ૧૦૦૦/- નું નર્મદા નિગમનું બોન્ડ આપવામાં આવેલ છે. જેની તાલુકાવાર વિગત નીચે મુજબ છે.

વિદ્યાલક્ષ્મી બોન્ડ ની તાલુકાવાર વિગત દર્શાવતું પત્રક

ક્રમ	તાલુકો	સંખ્યા
૧	ભુજ	૧૫૧૪
૨	અંજાર	૬૦૦
૩	ગાંધીધામ	૪૩૬
૪	ભચાઉ	૧૪૦૦
૫	રાપર	૨૨૧૭
૬	માંડવી	૪૦
૭	મુન્દ્રા	૮૭
૮	નખત્રાણા	૧૬૫
૯	લખપત	૩૩૨
૧૦	અબડાસા	૩૭૮
	કુલ	૭૧૬૮

વિનામુલ્યે પાઠ્યપુસ્તક વિતરણ

જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળામાં બાળકોને સરકાર દ્વારા પાઠ્યપુસ્તકનું વિતરણ મફત કરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ધો. ૧ થી ૮ માં નીચે દર્શાવેલ તાલુકાવાર મફત પાઠ્યપુસ્તકનું વિતરણ વર્ષ : ૨૦૧૭-૧૮માં કરવામાં આવેલ છે.

વિનામુલ્યે પાઠ્યપુસ્તક વિતરણ : (વર્ષ : ૨૦૧૭-૧૮)

ક્રમ	તાલુકાનું નામ	વિદ્યાર્થી ની સંખ્યા								
		ધો. ૧	ધો. ૨	ધો. ૩	ધો. ૪	ધો. ૫	ધો. ૬	ધો. ૭	ધો. ૮	કુલ
૧	ભુજ	૩૦૮૮	૩૦૭૩	૨૭૪૫	૩૨૧૬	૬૫૨૦	૬૮૮૨	૭૬૪૦	૭૧૭૪	૪૦૩૩૮
૨	અંજાર	૨૭૬	૨૪૬	૨૦૨	૩૬૪	૨૫૮૨	૩૮૬૫	૩૦૫૦	૨૭૬૨	૧૨૩૫૭
૩	ગાંધીધામ	૪૪૩	૪૪૩	૪૭૩	૪૧૧	૨૧૮૮	૨૩૮૭	૨૪૫૪	૨૩૪૬	૧૧૧૬૬
૪	ભચાઉ	૬૭૩	૬૭૩	૪૪૨	૮૦૭	૩૮૦૦	૪૧૭૧	૪૨૧૮	૩૮૮૪	૧૮૬૬૮
૫	રાપર	૧૪૩૦	૧૪૨૫	૧૬૭૩	૧૫૫૮	૧૬૮૫	૪૭૧૧	૫૮૧૬	૫૧૮૦	૨૩૫૮૮
૬	માંડવી	૭૦૮	૬૬૦	૭૧૮	૭૧૫	૩૨૧૫	૩૫૩૨	૩૭૧૧	૩૪૭૨	૧૬૭૩૨
૭	મુન્દ્રા	૧૬૫	૧૪૦	૧૪૪	૧૪૮	૧૮૨૧	૨૨૩૨	૨૪૮૭	૨૪૫૦	૮૬૮૭
૮	નખત્રાણા	૭૮૨	૭૮૩	૭૫૦	૫૭૫	૨૪૮૦	૨૬૮૪	૨૮૮૩	૨૮૮૨	૧૪૦૭૮
૯	લખપત	૨૬૮	૨૬૮	૨૨૭	૨૨૮	૧૨૧૪	૧૨૧૪	૧૩૮૫	૧૩૫૬	૬૧૬૨
૧૦	અબડાસા	૪૩૭	૪૩૭	૪૦૮	૩૪૩	૨૨૫૦	૨૧૭૮	૨૩૫૭	૨૬૦૩	૧૧૦૧૪
	કુલ	૮૨૮૩	૮૧૫૮	૭૭૮૩	૮૩૬૬	૨૭૮૮૬	૩૨૮૭૬	૩૬૨૧૨	૨૪૨૨૮	૧૬૩૮૦૪

પ્રજ્ઞા પાઠ્યપુસ્તક વિતરણ

ક્રમ	તાલુકાનું નામ	વિદ્યાર્થી ની સંખ્યા					
		ધો. ૧	ધો. ૨	ધો. ૩	ધો. ૪	ધો. ૫	કુલ
૧	અબડાસા	૧૭૮૦	૧૭૮૦	૧૭૭૫	૧૫૩૨	૬૪	૬૯૩૧
૨	અંજાર	૨૫૦૯	૨૨૭૯	૨૪૮૭	૧૯૫૨	૧૩૩	૯૩૬૦
૩	ભચાઉ	૨૮૩૭	૨૮૩૭	૨૯૫૪	૨૮૫૪	૮૯	૧૧૫૭૧
૪	ભુજ	૩૯૬૩	૩૯૬૩	૩૬૪૭	૨૬૬૪	૭૫	૧૪૩૧૨
૫	ગાંધીધામ	૧૬૬૨	૧૬૬૨	૧૬૬૪	૧૬૪૨	૬૪	૬૬૯૪
૬	લખપત	૧૦૫૮	૧૦૫૮	૧૦૨૭	૧૦૨૧	૮૨	૪૨૪૬
૭	માંડવી	૨૪૬૪	૨૪૦૮	૨૩૫૯	૨૧૯૯	૧૧૧	૯૫૪૧
૮	મુન્દ્રા	૧૭૭૯	૧૭૭૯	૧૮૮૧	૧૬૮૫	૩૧	૭૧૫૫
૯	નામત્રાણા	૧૭૯૩	૧૭૯૭	૧૮૪૧	૧૫૫૪	૬૨	૭૦૪૭
૧૦	રાપર	૩૩૪૫	૩૩૮૦	૩૧૨૩	૩૫૭૨	૪૯	૧૩૪૬૯
	કુલ	૨૩૧૯૦	૨૨૯૪૩	૨૨૭૫૮	૨૦૬૭૫	૭૬૦	૯૦૩૨૬